

ભાવનગર મહાનગરપાલિકા- ભાવનગર

:- Junior Clerk ની સીધી ભરતી માટે પ્રોવિઝનલ મેરીટ લીસ્ટના ઉમેદવારો માટે કોમ્પ્યુટર ટાઇપીંગની અગત્યની સુચનાઓ :-

કોમ્પ્યુટર ટાઇપીંગ ટેસ્ટનાં કેન્દ્રનું નામ અને સરનામું	કોમ્પ્યુટર ટાઇપીંગ ટેસ્ટની તારીખ	પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થવાનો સમય (રિપોર્ટીંગ સમય)	કોમ્પ્યુટર ટાઇપીંગ ટેસ્ટનો સમય
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ, સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગર	તા.૨૩/૦૨/૨૦૨૦, રવિવાર	સવારે ૧૦-૦૦ કલાકે	બપોરે ૧૨-૦૦ કલાકે

- ઉમેદવારોએ આ સાથેની તમામ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને તેનો કોમ્પ્યુટર ટાઇપીંગ ટેસ્ટ દરમ્યાન ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- આ કોમ્પ્યુટર ટાઇપીંગ ટેસ્ટ ફક્ત કોમ્પ્યુટર ટાઇપીંગની આવડત નક્કી કરવા માટે લેવામાં આવનાર છે, તેમાં મેળવેલ માર્ક્સ ઉમેદવારનાં ફાયનલ મેરીટમાં ગણવામાં આવશે નહિ. પરંતુ, આ કોમ્પ્યુટર ટાઇપીંગ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે.
- આ ટાઇપીંગ ટેસ્ટ પાસ કરનાર ઉમેદવારને જ તેનાં લેખિત પરીક્ષા બાદનાં નિયત થયેલ ફાયનલ મેરીટનાં આધારે નિયમોનુસાર જે-તે કેટેગરીમાં હાઈએસ્ટ મેરીટ મુજબ નિમણુંક આપવામાં કે વેઈટીંગ-લીસ્ટમાં રાખવામાં આવશે.
- આ કોમ્પ્યુટર ટાઇપીંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ ગણવામાં આવશે અને આ ભરતી આ જગ્યા પર તેઓનો કોઈ હક્ક-દાવો રહેશે નહિ, જેની ખાસ નોંધ લેવી.
- આ કોમ્પ્યુટર ટાઇપીંગ ટેસ્ટ / પરીક્ષાના કુલ બે ભાગ છે -
(૧) ગુજરાતી ટાઇપીંગ (ગુજરાતી ઈન્ડીક / શ્રુતિ ફોન્ટમાં) - સમય ૧૫ મિનીટ
(૨) અંગ્રેજી ટાઇપીંગ - સમય ૧૫ મિનીટ
- દરેક ટેસ્ટમાં ૧૫ મિનીટમાં ૧૨૫૦ કી-ટીપ્રેશન જેટલી ઓછામાં ઓછી ઝડપને જ માન્ય ગણવામાં આવશે.
- બન્ને ટેસ્ટમાં ૪૦ % પાસીંગ માર્ક રાખવામાં આવેલ છે અને સ્કોરીંગ પેટર્ન નિચે મુજબ રહેશે -

ઉદાહરણ તરીકે -

If, Total Master Key Strokes in the given Paragraph for typing =	1766
And Total Marks =	20
Then, Marks per Correct Key stroke = $20 / 1766 =$	0.011325

Sr No	Roll No	Master Paragraph Key Strokes	Candidate Key Strokes	Total	Error Key- strokes	Correct Key Strokes	Obtained Marks
(a)	(b)	(c)	(d)		(e)	(f)	(h)
						(d) - (e)	(f) x 0.011325
1	418	1766	1762		37	1725	19.535
2	6	1766	1771		77	1694	19.184
3	129	1766	1741		58	1683	19.059

- ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગ પ્રેક્ટીસ માટે લોગ-ઇન કર્યા પછી 5 મીનીટ નો પ્રેક્ટીસ સમય ફાળવવામાં આવેલ છે. જે સમય દરમ્યાન દરેક ઉમેદવારે ગુજરાતી ઈન્ડીક/શ્રુતિ ફોન્ટમાં પોતાના દ્વારા ઉપયોગ થનાર કી-બોર્ડ લેઆઉટ સિલેક્ટ કરી ચકાસણી કરી લેવી, અને સિસ્ટમના કી-બોર્ડ અને માઉસની પણ ચકાસણી કરી લેવાની રહેશે. પોતાની ટાઇપીંગની ભાષાને "Alt+Shift" કી ની મદદ થી અંગ્રેજી કે ગુજરાતી કરી શકે છે. જો તકલીફ લાગે તો નિરીક્ષકનું પરીક્ષા ચાલુ થતા પહેલા ધ્યાન દોરવું.
- ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગમાં પ્રશ્ન ફકરો કોમ્પ્યુટર સ્ક્રીનના ઉપરના અડધા ભાગમાં આપવામાં આવશે. જેને જોઈને તેની નીચે આપેલ સ્ક્રીનમાં ટાઇપીંગ કરવાનું રહેશે. ફકરાની પ્રિન્ટ આઉટ આપવામાં આવશે નહીં. ગુજરાતી ટાઇપીંગ પરીક્ષા શરૂ થતા પહેલા દરેક ઉમેદવારે ગુજરાતી ભાષા Indic સોફ્ટવેરથી સિલેક્ટ કરીને અને પ્રેક્ટીસ સમય દરમ્યાન સિલેક્ટ કરેલ કી-બોર્ડ લેઆઉટ, સિલેક્ટ છે તેની ચકાસણી કરી તૈયાર રહેવું. પરીક્ષા દરમ્યાન ઉમેદવારને આપેલ મર્યાદીત સમય દરમ્યાન ટાઇપીંગ કરેલ ફકરાને એડિટ કરી શકશે. પરીક્ષાનો ૧૫ મિનીટનો સમય પૂર્ણ થયા બાદ કે સબમિટ કરી દીધા પછી ઉમેદવાર દ્વારા ટાઇપ કરેલ ફકરાનો પ્રિવ્યુ જોઈને પોતાના પાસવર્ડથી કન્ફર્મ કરતા, ટાઇપીંગ પરીક્ષા પૂર્ણ થશે. જો ઉમેદવાર પોતાના પાસવર્ડ થી કન્ફર્મ નહી કરે તો 1 મિનીટમાં ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે.
- ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગની પરીક્ષા વચ્ચે 2 મિનીટનો વેઈટીંગ સમય રહેશે.
- ઉમેદવારે પરીક્ષા સોફ્ટવેર સિવાય કોઈપણ સોફ્ટવેર પરીક્ષા દરમ્યાન ઉપયોગમાં લીધેલ હશે તો તે ગેરરીતી ગણાશે.
- કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણ જેવા કે મોબાઇલ, બ્લુટૂથ, કેલ્ક્યુલેટર, લેપટોપ, પેજર, આઈ-પેડ વગેરે પરીક્ષા ખંડમાં લઈ જવા દેવામાં આવશે નહી અને તેમ ન કરતા થતી ચૂકની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.
- પરીક્ષામાં હાજરી આપતી વખતે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર તેમજ ઓળખ માટે ઈલેકશન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ કે સ્કુલ/કોલેજનું ફોટાવાળુ ઓળખપત્ર, આધાર કાર્ડ પૈકી કોઈપણ એક સાથે રાખવાનું રહેશે, જે વર્ગ-નિરીક્ષક માંગે ત્યારે બતાવવાનું રહેશે.
- ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર ખાતે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા- ભાવનગર

15. ઉમેદવારોએ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને કોમ્પ્યુટર ટાઈપીંગ ટેસ્ટ પાસ કરવાના રહેશે
16. દરેક ઉમેદવારે આ કોમ્પ્યુટર ટાઈપીંગ ટેસ્ટ પ્રથમ પ્રયત્ને જ પાસ કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર પ્રથમ પ્રયત્ને પાસ કરવામાં નિષ્ફળ જશે તો તે ઉમેદવારને ભરતી પ્રક્રિયાની આગળની કાર્યવાહીમાં બોલવવામાં આવશે નહિ. અને તેમની ઉમેદવારી રદ ગણવામાં આવશે
17. ઉમેદવારે પરીક્ષા શરૂ થતા પહેલા અટેલે કે ૧૧:૪૫ કલાક પહેલા ઉમેદવારે પ્રવેશ મેળવવાનો રહેશે. ત્યાર પછીથી પ્રવેશ મળી શકશે નહીં તથા આ બાબતે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
18. પાસ નોંધ- માત્ર ને માત્ર પ્રોવિઝનલ મેરીટ લીસ્ટના કુલ-૧૧૪ ઉમેદવારો એ જે પ્રવેશપત્ર OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનો રહેશે.
